

ત્વરિત જાહેરાત માટે

જાહેર થાય છે 2022/2023 પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન સિઝન

બ્રેમ્પટન, ઓન્ટારિયો (18 મે 2022) – સિટી ઓફ બ્રેમ્પટન આનંદ સહ જાહેર કરે છે તેમની 2022/2023 પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન સિઝન જેમાં હશે લાઇવ મ્યુઝિક, કોમેડી અને તમામ લોકો માણી શકે એવું રંગમંચનું મનોરંજન. બે મુખ્ય માલિકાઓમાં સમાયેલ હોય તેવા પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન પ્રોડક્શન્સ અને ટીસ ઈઝ બ્રેમ્પટનના માધ્યમથી પ્રેક્ષકગણ શહેરના ચારેયાર પર્ફોર્મિંગ આર્ટ્સના સ્થળો પર આ નિર્મિતીઓને માણી શકશે – દ રોજ, LBP થિએટર, સિરિલ ક્લાર્ક થિએટર અને ગાર્ડન સ્ક્વેર

આ સિઝનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન પ્રોડક્શન્સ રજૂ કરશે પ્રખ્યાત સંગીતકારો, કેનેડાના લિજન્ડ્સ, મહાન હાસ્ય કલાકારો અને વિશ્વ વિખ્યાત રંગમંચ અને સંગીતની મંડળીઓ જેમાં સમાવેશ થાય છે:

- ટોમ કોક્રેન સાથે રેડ રાઇડર (Tom Cochrane with Red Rider)
- કિન્કી બૂટ્સ (Kinky Boots)
- દ ટેનર્સ (The Tenors)
- જેક્સ ગિફ્ટ (Jake's Gift)
- જોહ્નની રીડ, લવ સમવન ટૂર (Johnny Reid, Love Someone Tour)
- વેનેસા વિલિયમ્સ (Vanessa Williams)
- કેનેડાના બેલે યોરગેન (Ballet Jörgen) દ્વારા પ્રસ્તુત એન ઓફ ગ્રીન ગેબલ્સ (Anne of Green Gables)
- સિર્ક ઓલ્ફોન્સે (Cirque Alfonse) દ્વારા રજૂ કરાયેલ એનિમલ (Animal)
- સેરેના રાયડર (Serena Ryder)
- શૉન મજૂમદાર, લવ ટૂર (Shaun Majumder, Love Tour)
- દ ઓરિજિનલ વેઈલર્સ (The Original Wailers)
- જૅન આર્ડન (Jann Arden)
- પેડિંગ્ટન ગેટ્સ ઈન અ જૅમ (Paddington Gets in a Jam)
- રોબર્ટ ક્રે (Robert Cray)
- પોલ રીઝર (Paul Reiser)
- લાઈટવાયર થિએટર (Lightwire Theater) દ્વારા નિર્મિત દ અગ્લી ડકલિંગ (The Ugly Duckling)

- બિગ રેક (Big Wreck)
- જસ્ટ ફોર લાફ્સ (Just fo Laughs)
- અને બીજું ઘણું બધું!

પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રમ્પટન સ્થાનિક કલાકારોને ઝળકાવવા માટે પ્રતિબદ્ધ છે અને તેથી સામુદાયીક સંગઠનો સાથે ભાગીદારી કરે છે જેથી બ્રમ્પટનની પ્રતિભાને ઝળકાવી શકાય, વિકસાવી શકાય અને તેને વધાવી લેવાય. સહ રજૂઆતના ભાગીદાર છે દ રોઝ ઓર્કેસ્ટ્રા, બ્રમ્પટન કન્સર્ટ બેન્ડ અને બ્રમ્પટન મ્યુઝિક થિએટર.

દિસ ઈઝ બ્રમ્પટન સ્ટુડિયો II માં પાછું ફરે છે અને રજૂ કરશે બ્રમ્પટનની જોરદાર પ્રતિભાઓ માટે એક ધનિષ્ઠ અને નિકટતમ પ્લેટફોર્મ અને સાથે જ કલાત્મક વિકાસની એક મહામૂલી તક. માલિકાના ક્યુરેટરોમાં સમાવેશ થાય છે બી-જાઝ (B-Jazzed), ઓફ ટ્રેકોર્ડ (off the record), સ્ટેન્ડ અપ સ્ટિચિઝ (Stand-Up Stitches), સાઉન્ડ ડ્રાઈવ રેકોર્ડ્સ (Soundrive Records), સ્પેડ્સ મિડિયા (Spades Media), ક્રેટ ક્લેશ (Crate Clash), QueeriAH!city, HYPE અને બ્લુબર્ડ બ્રમ્પટન (Bluebird Brampton)

COVID-19ની મહામારીમાંથી આપણે જ્યારે હજું ઊભા થઈ રહ્યા છીએ ત્યારે પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રમ્પટન, લાઈવ મનોરંજનને તમામ લોકો માટે કિફાયતી અને સુલભ થઈ શકે તે માટે પ્રતિબદ્ધ છે. સ્પર્ધાત્મક રહેવા માટે ટિકિટના દર ઘટાડવામાં આવ્યા છે જ્યાં વિવિધ શો માટે ટિકિટની કિંમત ફક્ત \$20 રાખવામાં આવી છે.

રોઝના સભ્યો માટે 2022/2023ની સિઝનની ટિકિટો મે 26 સુધી વેચાણમાં ઉપલબ્ધ છે અને જાહેર જનતા માટે જુન 10 સુધી મળશે. સમગ્ર સમયપત્રક જોવા માટે ટિકિટો ખરીદો અને વધુ જાણકારી મળવો, અહીં મુલાકાત લો therosebrampton.ca અથવા બોક્સ ઓફિસને 905.874.2800 પર કોલ કરો.

પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રમ્પટન અમારા સિઝન 2022-2023ના પ્રાયોજકોનો વિનમ્રપણે આભાર માને છે. 45 રેલરોડ, અલ્ગોમા યુનિવર્સિટી, ફિલ્ડગેટ ડિવલપમેન્ટ્સ, મેરિડિયન ક્રેડિટ યુનિયન, અને નોર્થવેસ્ટ લેક્સસ.

ગાર્ડન સ્ક્વેર ઈવેન્ટ્સ

ડાઉનટાઉન બ્રેમ્પટનના હાર્દમાં માણો કલા, સંસ્કૃતિ અને સમુદાયને. આખા ઉનાળામાં ગાર્ડન સ્ક્વેરમાં મફત મનોરંજનની મજા લો જેમાં સામેલ છે જુન 16થી શરૂ થતા ગુરૂવારના મૂવીઝ, પોપઅપ એક્ટિવેશનો, ફેસ્ટિવલો અને વિશેષ ઈવેન્ટ્સ.

- જૂન 19: TD દ્વારા પ્રસ્તુત પ્રાઈડ 2022
- જુલાઈ 9: 8મી વાર્ષિક ઈસ્ટ કોસ્ટ ક્રિયન પાર્ટી
- જુલાઈ 22 અને 23: વાઈબ્રન્ટ બ્રેમ્પટન (Vibrant Brampton)
- જુલાઈ 31: JAMBANA™ વન વર્લ્ડ ફેસ્ટિવલ (One World Festival)
- ઓગસ્ટ 13: સ્ટોમ્પ 'એન સ્ટેમ્પીડ (Stomp 'N Stampede)
- સપ્ટેમ્બર 30: સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન (National Day for Truth and Reconciliation); એક ખુલ્લી હવામાં થનાર કન્સર્ટ છે જેમાં ભાગ લેશે JUNO પુરસ્કાર વિજેતા આપણા માટીના લાલ પ્રોગ રોક બેલડી, કાઉન લેન્ડ્સ (Crown Lands).

ગાર્ડન સ્ક્વેરની સમર સિઝનને નો ફિલ્સ, TD, ટિમ હોર્ટન્સ અને ટોરોન્ટો પિઅરસન દ્વારા ઉદાર સમર્થન છે.

સુવાક્યો

"પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન આપણા શહેરમાં જબરદસ્ત વેન્યુ ચલાવે છે અને તેમની પાસે હજુ તો બીજી સિઝન તૈયાર છે જે મનોરંજનથી ભરપુર છે જેનો લુકત આખો પરિવાર ઉઠાવી શકશે. પર્ફોર્મિંગ આર્ટ્સમાં લોકોને સંગઠિત કરવાની શક્તિ છે અને આપણે હવે જ્યારે રૂબરૂ કહેવાય એવા ઈવેન્ટ્સ ફરી કરી રહ્યા છીએ ત્યારે ઉત્સુકતાથી રાહ જોવી ગમે એવી પર્ફોર્મન્સોની આખી લાઈનઅપ હોય તે કેવી આનંદની વાત છે. તમારો મનગમતો શો શોધો અને આજે જ ટિકિટો મેળવી લો!"

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"મને તો 2022/2023 સિઝનની લાઈનઅપ જોવાનો અતિશય આનંદ છે જ્યારે અમે ફરી રસીકોને આવકારી શકીશું એક જબરદસ્ત લાઈવ કાર્યક્રમો ભરેલા વર્ષમાં. બ્રેમ્પટન પચરંગી છે જ્યાં જ્યાં આપણે કલા, સંસ્કૃતિ અને મનોરંજનનો ઉત્સવ મનાવીએ છીએ અને મને તો આ શો જોવાની અત્યંત ઉત્સુકતા છે."

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"છેલ્લા લાંબાલયક કેટલાક વર્ષો બાદ આજે મને બ્રેમ્પટન ખાતે આવી આખી પ્રોગ્રામિંગ સિઝનને ફરી આવતી જોવા અતિશય રોમાંચ છે. સિટી ઓફ બ્રેમ્પટનની પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમે ખરેખર જોરદાર કામ કર્યું છે જેમાં તેઓ કોમેડી, સંગીત, નાટક, અને બીજી ઘણી બધી વસ્તુઓથી ભરેલી સિઝન તૈયાર કરી શક્યા છે જેમાં દરેક વયના લોકોને મજા પડી જાય."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

“આંતરરાષ્ટ્રીય અને કેનેડાના કલાકારોની સાથે, અમારી 2022-23 સિઝનમાં બ્રેમ્પટનના કલાકારોના વધુ કાર્યક્રમો હશે, બ્રેમ્પટનના કલા સંગઠનો સાથે વધુ ઊંડી ભાગીદારી હશે અને બ્રેમ્પટન માટે વધુ અવસરો ઊભા થશે જેમાં તે આપણા મંચો પર ઝળકી શકે અને કલાકારો માટે વધુ અવસરો હશે જ્યાં તેઓ બ્રેમ્પટનના પ્રેક્ષકોને જોઈ શકે અને આ પચરંગીપણાને વધાવી શકે.”

- સ્ટિવન સ્કિપર (Steven Schipper), એગ્ઝિક્યુટિવ આર્ટિસ્ટિક ડાયરેક્ટર, પર્ફોર્મિંગ આર્ટ્સ, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

સિટી ઓફ બ્રેમ્પટન ખાતેનું પર્ફોર્મિંગ આર્ટ્સ ડિવિઝન બ્રેમ્પટનની અનન્ય સાંસ્કૃતિક ઓળખ અને સર્જનાત્મક ગતિશીલતાને તેમની ઉત્કૃષ્ટતા તરફની દોડ અને સમુદાયમાં ઊંડી પ્રવૃત્તતાના માધ્યમથી દર્શાવે છે, તેનો વિકાસ કરે છે અને પ્રોત્સાહિત કરે છે. આ ડિવિઝન બ્રેમ્પટનમાં ચાર સ્થળોને સંચાલિત કરે છે: દ રોડ, LBP થિએટર, સિરિલ ક્લાર્ક થિએટર અને ગાર્ડન સ્કવેર [વધુ જાણકારી અહીં મેળવો](#).

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca